

PERMANENT MAGNETS LIMITED



B-3, MIDC, Village Mira, Mira Road East, Thane - 401107, Maharashtra, India

Phone : +91-22-68285454

Facsimile : +91-22-29452128

Email : sales@pmlindia.com

Website : www.pmlindia.com

Date: February 14, 2022

To,
Corporate Relation Department
The Bombay Stock Exchange Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001

Scrip Code : 504132

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Advertisement - Unaudited Financial Results for the Quarter and Nine months ended December 31, 2021.

Pursuant to Regulation 47 (3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company attached herewith the extract of the Unaudited Financial Results for the Quarter and Nine months ended December 31, 2021 that has been published in the Financial Express (English Daily Newspaper) and Daman Ganga Times (Gujarati Daily Newspaper) on February 12, 2022.

Further as required under Regulation 46 (2) the said result have also been placed on Company's Website at www.pmlindia.com and the Shareholders may refer to the same for details.

We request you to kindly take the same on record.

Thanking you,

Yours Faithfully,

FOR PERMANENT MAGNETS LIMITED

RACHANA RANE
COMPANY SECRETARY



Regd Office: Harsh Avenue, 302, 3rd Floor, opp. Silvassa Police Station, Silvassa Vapi Main Road,
Silvassa- 396 230. Dadra and Nagar Haveli (U.T.)

(All correspondence has to be made at our Mira Road address only)

CIN-L27100DN1960PLC000371



Bank of India BOI

Bank of India Building, Himmatnagar Branch, Himmatnagar
Mobile : 9571652407, 9537201542, 9724446464

NOTICE FOR PUBLIC AUCTION OF PLEDGED GOLD JEWELLERY/ORNAMENT/COINS

It is hereby brought to the notice of the following gold loan borrower, their legal heirs, persons engaged in business of gold jewelry/ornaments/coins and general public that in spite of repeated reminders/ notices by the Bank, the following borrowers are not repaying their dues to the Bank.

Notice is hereby published that if they fail to deposit all their dues in their respective gold loan accounts (including up-to-date interest and all costs charges/expenses) by 09.03.2022, then from 11:00am to 10:30pm on 09-03-2022 their Pledged Gold Jewellery /Ornament/Coins will be put for public auction in the Bank of India Himmatnagar Branch Premises for this, Bank shall not be held responsible for any inconvenience or damage caused to the concerned borrowers and no allegations or representations will be entertained from any borrowers in this regard.

Persons interested to take part in the bidding should deposit Rs. 500/- (Rupees Five Hundred Only) with the Branch Manager before the scheduled time/date towards earnest money. Persons having taken part in final bidding must be able to deposit full amount to the Bank within 48 hours, failing which their earnest money, deposited with the Bank will be forfeited. Bank reserves the right to cancel the auction without assigning any reasons in case, the bidding price so arrived at, is observed to be low or inadequate. Further, if need be, Bank reserves the right to change the date, time or place of the above scheduled auction or cancel the same without assigning any reasons thereon.

Account No.	Branch Name	Name of Borrower	Address	Gross weight of the Gold
240177610000826	HIMATNAGAR	MAGANSINH MADHUSINH PARMAR	MAGANSINH MADHUSINH PARMAR, At- Rampur Po - Gambhoi, Taluka Himmatnagar District Sabarkantha	19.490 Gram

Date : 12.02.2022, Place : Himmatnagar
Authorized Officer, Bank of India

THE SANDESH LIMITED

CIN:L22121GJ1943PLC000183
Registered Office: "Sandesh Bhavan", Lad Society Road,
Bih, Vastrapur Gam, P.O. Bodakev, Ahmedabad-380054 (Gujarat)
Phone No.:- (079) 40004000 • Fax :- (079) 40004242
Email:- investors@grievance@sandesh.com • Website:- www.sandesh.com

NOTICE OF RECORD DATE FOR PAYMENT OF INTERIM DIVIDEND FOR F.Y. 2021-22

Notice is hereby given that pursuant to the applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, read with the Companies Act, 2013 and the applicable Rules made thereunder, along with other applicable provisions, as amended from time to time, the Company has fixed Friday, February 25, 2022 (close of business hours) as the "Record date" for the payment of interim dividend @ 50% i.e. Rs. 5/- per Equity Share of Face Value of Rs. 10/- each, for the Financial Year 2021-22, as declared by the Board of Directors of the Company at their meeting held on February 11, 2022.

The said interim dividend shall be paid on Friday, March 4, 2022 to the equity shareholders of the Company, whose names appear in the records of the Depositories as beneficial owners of the shares held in electronic form and in the Register of Members of the Company as on Friday, February 25, 2022 (close of business hours), which is the Record Date fixed for the purpose.

The information contained in this Notice is also available on the website of the Company i.e. www.sandesh.com and also on the websites of the Stock Exchanges, where the Equity Shares of the Company are listed i.e. www.bseindia.com and www.nseindia.com.

Place : Ahmedabad
Date : February 11, 2022

For, The Sandesh Limited
Dhaval Pandya
Company secretary

PUBLIC NOTICE This is to inform public in general that Kotak Mahindra Bank Ltd. has organized an auction in below mention respect of vehicles

Asset Make & Model	Registration No.	YOM	Reserve Price (Rs.)	Address	Contact Details
Mahindra & Mahindra - CB Mahindra Blazo37 FBT Tipper	GJ16AU9908	2019	15,88,248	Kotak Mahindra Bank Ltd., K.G. Point, 3rd Floor, Near Ganga Palace, Ghod Dod Road, Surat-395007.	Mr. Prashant Chauhan 9825110646 & Mr. Adil Kasad 9825026292
Tata Intra - V20	GJ15AV0696	2020	3,83,440		
Eicher VE 3015 Pro	GJ04AW0976	2018	8,78,787	Kotak Mahindra Bank Ltd., Nath Edifice Complex, Dr. Yagnik Road, Opp. Jilla Panchayat, Rajkot-360001.	Mr. Dhaval Joshi 9099699989 & Mr. Dharmendrasinh Rana 9825611487
Eicher YECV Pro 3014	GJ04AW0360	2018	6,75,000		
Eicher YECV Pro 3014	GJ04AW0497	2018	6,75,000		
Tata Motors T- LPT 407	HR55AE3005	2018	4,62,466		
Tata Motors T3118FBGD	GJ25T6390	2009	5,28,000		
Ashok Leyland Limited AL4019FBTT without trolley	GJ12Z9965	2009	3,45,651	Kotak Mahindra Bank Ltd., Zone 1, 4th Floor, Siddhivinayak Complex, Shivranganji Cross Road, Satellite, Ahmedabad-380015.	Mr. Abhijitsinh Jadeja 7434032423 & Mr. Dhimant Patel 9825611485
Mahindra & Mahindra - CB Bolero BMT BS4	GJ27X8614	2019	3,50,000		
Maruti Suzuki - CB Maruti Super Carry	GJ38T3765	2019	2,00,000		
Volvo Eicher - CB VE 1075 Fully Built Passenger	GJ01BY3333	2008	2,23,361		
Volvo Eicher - CB VE 1075 Fully Built Passenger	GJ01CT7418	2010	2,58,566		

Under Hypothecation with M/s. Kotak Mahindra Bank Ltd. is under sale its "AS IS WHERE IS CONDITION". Interested parties can give their Quotations (Online / Offline) within 15 days from this paper publication i.e. on or before 26.02.2022 (Please note that closing Auction date would not be a Weekly off / Holiday).
Date : 12.02.2022

PERMANENT MAGNETS LIMITED

Regd Office: Harsh Avenue, 302, 3rd Floor, Opp. Silvassa Police Station, Silvassa - 396230, Dadra & Nagar Haveli (U.T.)
Corporate office: B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401107.
CIN: L27100DN1960PLC000371 • Email: investors@pmlindia.com • Phone: +91 22 68285454
Website: www.pmlindia.com

Extract of the Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2021

Sr. No.	Particulars	For the Quarter Ended		For Nine Months Ended		Year ended 31.03.2021
		31.12.2021 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.12.2020 (Unaudited)	
1.	Total Income from operations (net)	2,864.18	3,201.13	3,228.19	9,337.40	7,991.37
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	479.73	626.69	625.95	1,744.98	1,389.36
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	479.73	626.69	625.95	1,744.98	1,389.36
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	360.15	462.52	455.47	1,299.65	971.69
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	360.15	462.52	455.47	1,299.65	971.69
6.	Paid up Equity Share Capital (Face Value Per Share Rs. 10/-)	859.85	859.85	859.85	859.85	859.85
7.	Earnings Per Share (before and after Extraordinary items)					
1. Basic:		4.19	5.38	5.30	15.11	11.30
2. Diluted:		4.19	5.38	5.30	15.11	11.30

Note: The above is an extract of the detailed format of financial results for the Quarter and Nine Months ended December 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Nine Months ended financial results are available on the Stock Exchange websites viz. www.bseindia.com. The same is also available on the Company's website viz. www.pmlindia.com.

By order of the Board
Sd/-
Sharad Taparia
Managing Director

Place : Thane
Date : February 11, 2022

Public Notice For E-Auction Cum Sale (Appendix - IV A) (Rule 8(6))

Site of Immovable property mortgaged to IFHL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IFHL-HFL) Corporate Office at Plot No.98, Udyog Vihar, Phase-IV, Gurgaon-122015 (Haryana) and Branch Office at - Office No.701, 7th Floor, 21st Century Business Center, Near Udhna Darwaja, Ring Road, Surat - 395002 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter "Act"). Whereas the Authorized Officer ("AO") of IFHL-HFL had taken the possession of the following properties pursuant to the notice issued U/S 13(2) of the Act in the following loan accounts/prospect nos. with a right to sell the same on "AS IS WHERE IS BASIS & AS IS WHAT IS BASIS" for realization of IFHL-HFL's dues. The Sale will be done by the undersigned through e-auction platform provided at the website: www.bankeuctions.com.

Borrower(s)/ Co-Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount	Description of the Immoveable property/ Secured Asset	Date of Physical Possession	Reserve Price	
				15-Dec-2020	As On Date 10-Feb-2022
1. Mr. Mehul Mahida, 2. Mrs. Kanchanben Kantilal Mahida, 3. Mr. Kantilal C. Mahida (Prospect No. 879887)	02-Dec-2019 Rs. 12,11,455/- (Rupees Twelve Lakh One Thousand Four Hundred Fifty Five Only)	All that part and parcel of the property bearing Plot No-361, Aaryta Residency, Kareli, Palsana, Surat, Gujarat-394130. (Area:-456, Sq.ft)	Total Outstanding As On Date 10-Feb-2022 Rs.15,74,523/- (Rupees Fifteen Lakh Seventy Four Thousand Five Hundred Twenty Three Only)	Rs. 6,60,000/- (Rupees Six Lakh Sixty Thousand Only)	Earnest Money Deposit (EMD) Rs. 66,000/- (Rupees Sixty Six Thousand Only)
Date of inspection of property		EMD Last Date	Date/ Time of E-Auction		
02-Mar-2022 1100 hrs -1400 hrs		04-Mar-2022 till 5 pm.	07-Mar-2022 1100 hrs-1300 hrs.		

Mode of Payment - All payment shall be made by demand draft in favour of "IFHL Home Finance Limited" payable at Gurugram or through RTGS/NEFT The accounts details are as follows: a) Name of the account:- IFHL Home Finance Ltd., c) Account No:-S3105066294, d) IFSC Code:-SCBL0036025 or through Payment Link: https://quickpay.iffhlfinance.com.

Terms and Condition

- For participating in e-auction, intending bidders required to register their details with the Service Provider <https://www.bankeuctions.com>, well in advance and has to create the login account, login ID and password. Intending bidders have to submit / send their "Tender FORM" along with the payment details towards EMD, copy of the KYC and PAN card at the above mentioned Branch Office.
- The bidders shall improve their offer in multiple of amount mentioned under the column "Bid Increase Amount". In case bid is placed in the last 5 minutes of the closing time of the auction, the closing time will automatically get extended for 5 minutes.
- The successful bidder should deposit 25% of the bid amount (after adjusting EMD) within 24 hours of the acceptance of bid price by the AO and the balance 75% of the bid amount within 15 days from the date of confirmation of sale by the secured creditor. All deposit and payment shall be in the prescribed mode of payment.
- The purchaser has to bear the cess, applicable stamp duty, fees, and any other statutory dues or other dues like municipal tax, electricity charges, land and all other incidental costs, charges including all taxes and rates outgoing relating to the property.
- Bidders are advised to go through the website <https://www.bankeuctions.com> and <https://www.iffil.com/home-loans/properties-for-auction> for detailed terms and conditions of auction sale & auction application form before submitting their bids for taking part in the e-auction sale proceedings.
- For details, help procedure and online training on e-auction prospective bidders may contact the service provider at email ID:- support@bankeuctions.com, Support Helpline Numbers: 0791981124/25/26 and any property related query: Mr. Rajan Sharma 0997937887 E-mail: rajan.sharma@iffil.com.
- Notice is hereby given to above said borrowers to collect the household articles, which were lying in the secured asset at the time of taking physical possession within 7 days, otherwise IFHL-HFL shall not be responsible for any loss of property under the circumstances.
- Further the notice is hereby given to the Borrower/s, that in case they fail to collect the above said articles same shall be sold in accordance with Law.
- In case of default in payment at any stage by the successful bidder / auction purchaser within the above stipulated time, the sale will be cancelled and the amount already paid will be forfeited (including EMD) and the property will be again put to sale.
- AO reserves the rights to postpone/cancel or vary the terms and condition of tender/auction without assigning any reason thereof. In case of any dispute in tender/auction, the decision of AO of IFHL-HFL will be final.

15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002

The Borrower are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before the date of Tender/Auction, failing which the property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost

Place : Surat Date : 12-Feb-2022
Sd/- Authorised Officer, IFHL Home Finance Limited

GYSCOAL ALLOYS LIMITED

CIN: L27209GJ1999PLC036656
Corporate Office: 2nd Floor, Mrudul Tower, B/H Times of India, Ashram Road, Ahmedabad - 38009.
Regd Office: Plot No.2/3 GIDC, Ubhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana 382830, Phone. 079-26574878, Email: info@gysoal.com

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2021

(In Lacs Except EPS)

PARTICULARS	Quarter ended					
	31.12.2021		31.12.2020		31.03.2021	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1 Total Income	669.77	482.09	367.09	1,663.29	563.67	1,258.33
2 Net Profit / (Loss) for the period (before tax and exceptional and/or extraordinary items)	39.82	1.88	-856.93	25.51	-2,011.66	-9,235.88
3 Net Profit/(Loss) for the period before Tax (after exceptional items and/or extraordinary items)	39.82	1,124.73	-732.33	1,148.36	-11,329.01	-9,235.88
4 Net Profit for the period after tax (after Exceptional items and/or extraordinary items)	7.64	818.70	-687.83	533.89	-11,192.54	-7,449.42
5 Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	7.64	520.58	-687.83	535.77	-11,192.54	-7,402.18
6 Paid up Equity Share Capital (Face Value of Rs. 1/- each)	1,582.76	1,582.76	1,582.76	1,582.76	1,582.76	1,582.76
7 Earning per Share - Not Annualised (in ₹)						
1) Basic	-	0.33	-0.43	0.34	-7.07	-4.68
2) Diluted	-	0.33	-0.43	0.34	-7.07	-4.68

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2021

(In Lacs Except EPS)

PARTICULARS	Quarter ended					
	31.12.2021		31.12.2020		31.03.2021	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1 Total Income From Operations	669.77	482.09	367.09	1,663.29	563.67	1,258.33
2 Net Profit / (Loss) before tax	39.82	1,124.73	-732.33	1,148.36	-11,329.01	-9,235.88
3 Net Profit / (Loss) after tax	7.64	518.70	-687.83	533.88	-11,192.54	-7,449.42
4 Total Comprehensive Income for the Period	7.64	520.58	-687.83	535.76	-11,192.54	-7,402.18

Notes:

- Net profit for the above financial results have been reviewed and considered by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on February 11, 2022.
- The above is an extract of detailed format of Standalone and Consolidated financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosures Requirement) Regulation, 2015. The detailed Standalone and Consolidated financial results were reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on February 11, 2022. The full format of Standalone and Consolidated financial results are available on the Company's website www.gysoalalloys.com and on the website of the BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com
- The consolidated financial results include the financial result of the associate company viz. Goldman Hotels & Resorts Private Limited.
- The figures for the corresponding previous period have been regrouped/ reclassified wherever necessary, to make them comparable.

Date: 11-02-2022
Place: Ahmedabad

For and on behalf of Gysoal Alloys Limited
Sd/
Dipali M Shah - Director

THE BARODA RAYON CORPORATION LIMITED

Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220, (T) 0261-2899555
Email: brcsurat@gmail.com | CIN - L45100GJ1958PLC000892 | website-www.brcin

Extract of Standalone Un-audited Financial Results for the Quarter & nine months ended 31st December, 2021

(In Lakhs Except EPS)

Sr. No.	Particulars	Quarter ended		
		31.12.2021	31.12.2021	31.12.2020
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1 Total income from operations	-	-	-	
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	210.18	1931.44	(24.00)	
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#)	210.18	1931.44	(24.00)	
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	210.18	1931.44	(24.00)	
5 Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	44991.35	46712.61	(24.00)	
6 Equity Share Capital	2291.14	2291.14	2291.14	
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	-	-	
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
Basic:	0.92	8.43	(0.10)	
Diluted:	0.92	8.43	(0.10)	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) and company's website (www.brcin).

For The Baroda Rayon Corporation Limited
Sd/-
Damodarbhai Patel
Managing Director
DIN-00056513

Date : 11-02-2022
Place : Surat.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
Central Bank of India

Sahar Darwaja
Textile Market Branch, Surat

APPENDIX (B) - POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the authorized officer of the Central Bank of India, Sahara Darwaja Textile Market Branch Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12), 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09.11.2021 calling upon the Borrower/Guarantor M/s. All Met Cast Partnership Firm, Mr. Mayankkumar Jitendrabhai Patel, Mr. Ashokkumar Ishwarbhai Patel, Mrs. Ilaben Ashokbhai Patel, Mr. Prabhu Jagvan Patel and Mrs. Laxmben Prabhuraj Patel to repay the amount mentioned in the notice being Rs. 93,31,821/- (Rupees: Ninety Three Lakhs Thirty One Thousand Eight Hundred Twenty One Only) as on 09.11.2021 along with interest due thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this **8th day of February of the year 2022**.

The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, Sahara Darwaja Textile Market Branch, Surat for an amount Rs. 93,31,821/- (Rupees: Ninety Three Lakhs Thirty One Thousand Eight Hundred Twenty One Only) and interest & other charges thereon with effect from 09.11.2021 (Amount deposited after issuing of demand notice U/Section 13(2) has given effect).

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

Description of the Immoveable Property

All that piece and parcel of land bearing Plot No. 11, admeasuring about 83.60 sq. mtrs. of "Shiv Ashish Row House Society" situated on the land bearing Revenue Survey No. 134 + 139, of Village- Adajan, taluka City Dist- Surat and F No. 6 paki of T P Scheme no. 13 (Adajan), Mortgaged deed SRT/1/ATV/19467/2017-, Dated- 25.09.2017. Bounded by: East:- Adj. Internal Society Road, West:- Adj. Shiv Campus, North:- Adj. Row House no. 12, South:- Adj. Row House no. 10.

Date: 08/02/2022
Place: Surat
Authorized Officer
Central Bank of India

